



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૦/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૦૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૮ કેસ કરી, ૫૭ વ્યક્તિઓને ઝડપી, ૩૯૯ લીટર દેશી દારૂ, ૨૦૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૨૬ ક્વોર્ટર ઈંગ્લીશ દારૂ, ૩૩૦ બિયર ટીન, ૦૧ કાર અને ૦૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૭,૮૧૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૦૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૧૦૮/૧૮

વસ્ત્રાપુર: સૌરભભાઈ મોહનભાઈ ગુપ્તા (ઉ.વ.૨૬)(રહે.સીમંધર બંજ્લોઝ રામનગર રોડ સાબરમતી) એ તા.૨૭/૧૦/૧૮ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૯/૧૮ થી તા.૧૦/૧૦/૧૮ સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) ચીરાગ રાહોડ (રહે.ગોતા હાઉસીંગ બોર્ડના મકાનમા, ગોતા) તથા (૨) મીહીર સોલંકી (રહે.બોપલ) એ ભેગામળી વસ્ત્રાપુર ઈન્દ્રપ્રસ્થ ટાવરમા આવેલ ખુશી મોબાઈલ નામની સૌરભભાઈની દુકાનમાંથી સેમસંગ, વીવો તથા ઓપ્પો કંપનીના મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા ૧૦,૭૩,૦૦૦/- નો માલ મેળવી લઈ, તે પેટેના રૂપિયા નહી ચુકવી સૌરભભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એસ.જાડેજા ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયો-

સમાચાર યાદી નં.૨૧૦૯/૧૮

માધવપુરા : સાક્ષીબહેન ડો/ઓ કમલેશભાઈ જૈન (ઉ.વ.૨૧)(રહે.પદ્માવતી એપાર્ટમેન્ટ, કુલવાળી ગલીમાં, શાહીબાગ) તા.૨૬/૧૦/૨૦૧૮ રાતના ૯/૫૫ વાગ્યાના સુમારે દિલ્હી દરવાજા બહાર સર્કલ પર અંબાજી માતાના મંદિર બાજુ વળાંક લેતા રોડ પર થી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમિયાન મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યો પુરૂષ સાક્ષીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ સાક્ષીબહેન જૈને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.ડી.બારોટ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૧૧૦/૧૮

ઇસનપુર : જીતેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (રહે. શ્રીનિવાસ એપાર્ટમેન્ટ સિધ્ધનાથ પાર્ક સોસાયટીની પાસે ઘોડાસર વટવા) એ તા.૨૭/૧૦/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૧૦/૧૮ સવારના ૪/૦૦ વાગ્યાના સુમારે નારોલ સર્કલ ખાતે આવેલ બાલક્રિષ્ણ ટેક્ષટાઇલ પ્રા.લી. માં બીજા માળે થી ખુલ્લા બારી-બારણામાંથી અજાણી વ્યક્તિ અંદર પ્રવેશ કરી, પ્રીટીંગની સ્કીનો બનાવવાના મશીનની પ્લેટોનો સેટ નંગ-૦૫ કુલ કિંમત રૂપિયા ૮,૬૩,૩૮૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વા.જી.માથુકીયા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૧૧૧/૧૮

વાડજ : મનીષકુમાર સુરેશચન્દ્ર દવે (રહે.શિવાલી એપાર્ટમેન્ટ અખબારનગર ચાર રસ્તા નવા વાડજ) એ તા.૨૭/૧૦/૧૮ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૧૦/૨૦૧૮ રાતના ૧૧/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી નંબર જીજે.૦૧. એચ.૬બલ્યુ.૮૯૯૮ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની ચોરી તા.૧૮/૧૦/૧૮ ના કલાક ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઇ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.બી.ગઢવી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૧૧૨/૧૮

કારંજ : રાહુલકુમાર ઉર્ફે લાલો સ/ઓ માધુભાઈ પરમાર (ઉ.વ.૨૭)(રહે.બાકરઅલીની ચાલી જુની સિવિલની પાછળ ધી કાંટા) એ પત્ની પિયરમા રહેતી હોઇ મનમાં લાગી આવતા તા.૨૭/૧૦/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કારંજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.ઓડેદરા ચલાવે છે.

નિકોલ : સવિતાબહેન પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮)(રહે.સ્વામી વિવેકાનંદનગર ચાર માળીયા મંગલ પાંડે હોલની સામે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૨૭/૧૦/૧૮ સવારના ૧૦/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી સી.આર.સોલંકી ચલાવે છે.

મણીનગર : પાયલ ઉર્ફે મમતાબહેન વા/ઓ ઓમકારનાથ જોગી(રહે.આનંદધામ એપાર્ટમેન્ટની નીચે ઓરડીમા સલવે હોટલની ગલીમાં રામલાલનગર મણીનગર) એ અગમ્ય કારણસર તા.૨૬/૧૦/૧૮ સાંજના ૭/૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.પરમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.